

વાભાર્થીનું નામ:- શ્રી અનિલભાઈ જશુભાઈ સોલંકી

યોજનાનું નામ:- સીધા ધિરાણ યોજના

ધિરાણનું વર્ષ-૨૦૧૭-૧૮

યુનિટનું નામ:- પેસેન્જર વાહન

ધિરાણની તારીખ:- ૦૧/૧૨/૨૦૧૭

ધિરાણની રકમ ; - ૪,૯૩,૧૩૫/-



## પેસેન્જર વાહન

મારું નામ અનિલભાઈ જશુભાઈ સોલંકી છે.હું નરખડી,નવી નગરી,પો.પોઈયા,તા.નાંદોદ, જિ.નર્મદામાં રહું છું.હું રાજપીપલા,જિ.નર્મદાની શાળાઓમાં બાળકોને લાવવા – મુકવા માટે બીજાની ગાડી પર ડ્રાઈવર તરીકે સ્કુલવાન ચલાવતો હતો.મને માસિક પગાર રૂ.૩૫૦૦/- પગાર મળતો હતો. તે દરમ્યાન છાપામાં મેં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની જાહેરાત વાંચી.જાહેરાત વાંચ્યા બાદ મેં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મળતા લાભ અંગેની જાણકારી મેળવી તેમજ ધિરાણનો લાભ લેવા માટે આગળ કોઈ સારી નોકરીની શક્યતા ન લાગી.જેથી મે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેળવેલ ફોર્મમાં પેસેન્જર વાહન ધંધા માટે અરજી કરી.તેમજ જરૂરી કાગળો રજૂ કર્યા અને મારી રૂ.૪,૯૩,૧૩૫/- (અંકે રૂપિયા ચાર લાખ ત્રણ હજાર એકસો પાત્રીસ પુરા) ની લોન મંજૂર કરી મને નિગમ તરફથી ઈકો ગાડી આપી.ત્યારબાદ મે ડ્રાઈવરની નોકરી છોડી મે છોકરાઓને સ્કુલે લાવવા મુકવા માટે મારો પોતાનો ધંધો શરૂ કર્યો.ત્યારબાદ મારા કુટુંબનું ગુજરાન સારી રીતે ચાલે છે.મારા છોકરાઓને પણ સારી શાળામાં અભ્યાસ કરાવી શકુ છું અને લોનના હતા પણ નિયમિત રીતે

ભરાય છે.આમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની લોન મળ્યા બાદ મારા જીવન ધોરણમાં સુધારો થયો છે.

જિલ્લા મેનેજર  
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ  
રાજપીલા,જિ.નર્મદા

લાભાર્થીનું નામ:- શ્રી યોગેશકુમાર જશુભાઈ સોલંકી

યોજનાનું નામ:- સીધા ધિરાણ યોજના

ધિરાણનું વર્ષ-૨૦૧૯-૨૦

યુનિટનું નામ:- અનાજ કરીયાણા

ધિરાણની તારીખ:- ૨૨/૧૦/૨૦૧૯

ધિરાણની રકમ :- ૨૦૦૦૦૦/-



### અનાજ કરીયાણીની દુકાન

મારૂ નામ સોલંકી યોગેશકુમાર જશુભાઈ છે.હું રોયલ સનસીટી, સી-૨૭૭,વડીયા રોડ,તા.નાંદોદ, જિ.નર્મદામાં રહુ છું.હું પોતે છુટક પરચુરણ પાન-બીડી,ગુટવાનો ધંધો કરતો હતો.સવારે વહેલો ઉઠીને સામાન વેચાણ કરવા એક ગામથી બીજા ગામ ધંધા માટે જતો હતો.સાંજે પડે ત્યારે માલ-સામાન વેચી ઘરનું ગુજરાન

યલાવતો હતો.તે દરમ્યાન છાપામાં મેં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ જાહેરાત વાંચી.જાહેરાત વાંચ્યા બાદ મેં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મળતા લાભ અંગેની જાણકારી મેળવી તેમજ ધિરાણનો લાભ લેવા માટે આગળ કોઈ સારી નોકરીની શક્યતા ન લાગી.જેથી મેં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેળવેલ ફોર્મમાં અનાજ કરીયાણા ધંધા માટે અરજી કરી.તેમજ જરૂરી કાગળો રજૂ કર્યા અને મારી રૂ.૨૦૦૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ પુરા) ની લોન મંજૂર થઈ ત્યારબાદ મેં એજ લોનના પૈસામાંથી એક દુકાન ભાડે રાખી ધંધાની શરૂઆત કરી.આ ધંધામાં દુકાનનું લાઈટ બીલ તથા દુકાનનું ભાડુ કાઢતા મને રૂ.૬૦૦૦/- થી રૂ.૮૦૦૦/- માસિક ચોખ્ખી આવક થાય છે.મારા કુટુંબનું ગુજરાન સારી રીતે ચાલે છે.મારા છોકરાઓને પણ સારી શાળામાં અભ્યાસ કરાવી શકું છું અને લોનના હતા પણ નિયમિત રીતે ભરાય છે.આમ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની લોન મળ્યા બાદ મારા જીવન ધોરણમાં સુધારો થયો છે.

જિલ્લા મેનેજર  
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ  
રાજપીલા,જિ.નર્મદા